

B.Com. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
Indirect Tax Law-2 (Dse-3 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	GST હેઠળ નોંધણીની પ્રક્રિયા વર્ણવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન-૧	GST હેઠળ નોંધણી રદ કરવાની પ્રક્રિયા વર્ણવો.	
પ્રશ્ન-૨	A. GST હેઠળ ટેક્સ ઇન્વોઇસનું મહત્વ ચર્ચો.	(૧૦)
	B. ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટેની શરતો અને પાત્રતા જણાવો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન-૨	A. બિલ ઓફ સપ્લાય	(૧૦)
	B. પેમેન્ટ વાઉચર	(૧૦)
પ્રશ્ન-૩	કસ્ટમ કાયદાની બંધારણીય જોગવાઈઓ જણાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન-૩	કસ્ટમના કાયદાનો અર્થ અને તેનો ખ્યાલ સમજવો.	
પ્રશ્ન-૪	નીચેમાંથી કોઈપણ બે ના જવાબ આપો	(૧૫)
	A. મૂળભૂત કસ્ટમ ડ્યુટી	
	B. વધારાની કસ્ટમ ડ્યુટી	
	C. સલામત કસ્ટમ ડ્યુટી	
	D. એન્ટી ડમ્પીંગ ડ્યુટી	

ENGLISH VERSION

Que-1	Describe the registration procedure under GST.	(20)
	OR	
Que-1	Describe the procedure for cancellation of registration under GST.	
Que-2	A. Discuss the importance of text invoice under GST	(10)
	B. Explain the eligibility and condition for taking input tax credit.	(10)
	OR	
Que-2	A. Bill of Supply	(10)
	B. Payment Voucher	(10)
Que-3	Describe the constitutional provisions of custom law.	(15)
	OR	
Que-3	Explain in detail the meaning and concept of custom law.	(15)
Que-4	Give any two answers.	(15)
	A. Basic custom duty.	
	B. Additional custom duty.	
	C. Safeguard custom duty.	
	D. Anti- Dumping duty.	
